

Date: 03.02.2026

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Tower,
Dalal Street, Fort,
Mumbai-400 001.
Company Code: 519471

Ref: Script Code: - 519471, Script ID: - AMBARPIL

Dear Sir


**SUB.: NEWSPAPER CLIPPINGS OF THE AUDITED STANDALONE FINANCIAL RESULTS
OF THE COMPANY FOR THE QUARTER AND FINANCIAL YEAR ENDED DECEMBER 31,
2025.**

Pursuant to Regulation 47 of SEBI (Listing Obligations & Disclosure Requirements) Regulations, 2015, We are enclosing herewith the copies of the Newspaper clipping of UnAudited Financial Results of the Company for the Quarter and Nine months ended 31, December, 2025 as published in English and Gujarati (Vernacular language) Newspapers on February 03, 2026.

The clippings may also be accessed on the website of the Company at <https://www.ambarprotein.com>.

We request you to take the same on record.

FOR, AMBAR PROTEIN INDUSTRIES LIMITED


Compliance Officer



Plot No. 351, 353, 358, Opp. Bhagyoday Hotel, Sarkhej - Bavla Highway, Changodar, Ta. Sanand, Dist. Ahmedabad - 382213, Gujarat. | **P:** (02717) 250220 / 221 / 410 | **F:** (02717) 297123
E: ambarprotein@gmail.com | **W:** www.ambarprotein.com

GSTIN No.: 24AABCM0541N1ZM | **PAN No.:** AABCM0541N | **CIN No.:** L15400GJ1992PLC018758
Subject to Ahmedabad Jurisdiction

Boost to capex, services sector growth and AI to support FY27 earnings: Report

New Delhi, Feb 2 (IANS) A likely boost to capex, services sector growth and AI in the Union Budget, along with slightly slower than expected fiscal consolidation, will likely support FY27 earnings, further helped by increased demand for equities through buybacks, Morgan Stanley has said.

The Budget's debt-to-GDP reduction with slow fiscal consolidation and support for growth through cyclical and structural measures.

"We remain constructive on India equities. Overweight Financials, Consumer Discretionary and Industrials," the global brokerage said in its note.

The Budget balances

CHANGE OF NAME

I have changed my old name from KANHAYALAL TARACHANDRA to new name KANHAYALAL TARAJI SUTHAR Add: 38, Kshetra Villa, Vastral, Ahmedabad-382418

CHANGE OF NAME

I have changed my old name from SAHIL ISMAIL MODAN to new name SHAHIL ISMAIL MODAN Add: 1969/7, Shanti Estate Near Jay Sunders Hill, Rakhad Ahmedabad-461318

CHANGE OF NAME

I have changed my old name from METALIYA JAYKUMAR ASHOKBHAI to new name METALIYA JAY ASHOKBHAI Add: B-1001, Sanskar Lake View, Nikol, Ahmedabad-382350

CHANGE OF NAME

I have changed my old name from PATEL BIJAL PRAVINKUMAR to new name PATEL BIJAL MANDIP Add: B-701, Sarthak Shreeji

CHANGE OF NAME

I have changed my old name from BINALBEN PARESH SHAH to new name BINALBEN PARESH SHAH Add: A-202, Kalathir Apartment, Gate-2 Ghadiotia Ahmedabad-380061

CHANGE OF NAME

I have changed my old name from HAMDAN YAKUBBHAI RAJPURA to new name HAMDANBHAI YAKUBBHAI RAJPURA Add: At-Pamol Tal-Vilapur

Special counsel grills CEO of Coupang affiliate in severance pay probe

Seoul, Feb 2 (IANS) A special counsel team has questioned the top executive of a Coupang Corp. affiliate over allegations of unpaid severance pay for company employees. Chung Jong-chul, CEO of Coupang Fulfillment Services (CFS), a logistics subsidiary of Coupang, appeared at the office of special counsel Ann Gweon-seob in the morning to be grilled as a suspect about the company's severance pay dispute.

Chung and his predecessor, Eom Seong-hwan, are suspected of changing the company's employment rules in May 2023 to the disadvantage of its employees who have worked for more than one year and failing to pay their severance pay, reports Yonhap news agency. Under the revised regulations, daily workers employed for over one year are eligible for

severance pay only when they have worked for more than 15 hours per week every week. Previously, they were paid severance, with any weeks when they worked fewer than 15 hours excluded from the total. In other words, if there is even one time during the employment period when their weekly working hours are fewer than 15 hours, the retention allowance calculation period is reset. The current retirement benefits law stipulates that an employee is eligible for severance pay if the continuous employment period is one year or longer and the average weekly working hours over four weeks are 15 hours or more. The special counsel team has already questioned Eom as a suspect and raided Coupang Corp. and CFS headquarters.

The team reportedly seized an internal CFS document that estimates the company could save tens of billions of won by changing its employment rules. Earlier, the interim CEO of Coupang underwent 12 hours of intensive police questioning over allegations of destruction of evidence linked to a massive data breach at the e-commerce company. Harold Rogers emerged from the Seoul Metropolitan Police Agency on Saturday, declining to answer reporters' questions on whether he admitted to the

charges or intended to report the company, reports Yonhap news agency. Rogers faces accusations of obstructing official investigations into the breach estimated to have affected nearly 33 million users. Coupang had independently announced that data from over 3,000 accounts was leaked, a figure authorities dispute. Police, who suspect more than 30 million accounts were affected, are investigating the reliability of Coupang's internal probe. The government has criticised the company's findings as one-sided.

GUJARAT WATER SUPPLY AND SEWERAGE BOARD

TENDER NOTICE NO: SK/11 of 2025-26

Unit Rate For Three Year

Gujarat Water Supply & Sewerage Board (GWSB) E-Tender for Hiring of Diesel driven Non-A-C & SUV Type Buses/Mahindra Buses/Neo/Kia Carenus Kia Carens Covic or equivalent inspection vehicles for offices under zone-II (Except Banaskantha and Patalan) GWSB for fixing the unit rate for three years period from Bidders who have minimum 1 (One) Nos Taxi/Maxi passing vehicle model of the vehicle is January 2021 or there after in his/her firm name & should have GST No & PAN No. (Tender ID:27198)

Pre-bid meeting on Dtd:09/02/2026 at 15.00 Hrs. at GWSB, Ahmedabad.

Last date of Online Submission of Tender: 17/02/2026 at 18:00 Hrs. Bid Opening Date: 18/02/2026 at 12.00 Hrs. (If possible)

Contact Office: P/H Mech Store Division, Block-A, 2nd floor, Patanagar Yojana Bhavan, Sector-16, Gandhinagar-382016 Phone: 9978406779

The detailed tender notice and tender documents are available on <http://tender.nprocure.com>

GWSB has all the rights to cancel the tender without any reason. For Village Level Drinking water Complaint Please contact our Toll Free No:1916

INF/2477/2025-26

GUJARAT MARITIME BOARD

Tender Notice No.14 of 2025-26

On Behalf of the Chairman, Gujarat Maritime Board, Executive Engineer (Mech.), (Tel Phone No.028-2712516) Jamnagar invites on-line tenders for below mentioned works.

Sr. No	Name of Works	Estimated Amount
1	AMC of electrical installation at Jamnagar group of ports	Rs. 42,02,051/-

Schedule of E-Tendering

Tender uploading starting Date: 02/02/2026 from 10:00 Hrs.

Last date of tender uploading: 16/02/2026 till 18:00 Hrs.

Last date of submission of Physical documents: From 17/02/2026 to 24/02/2026 up to office hours

Online opening of Bid: 29/02/2026 at 12.00 Hrs. (if possible)

All other details as per tender document. Bidder can view, download, & submit their bid through www.tender.nprocure.com only. Tender documents will also available on GMB website: www.gmbports.org

INF/2477-02, 04, 06, 08/2025

AMBAR PROTEIN INDUSTRIES LIMITED

(CIN: L15405GU1992PLC018758)

(Regd. Off-: Sarkej-Bava Highway, Opp Bhagdayn Hotel, Chanderi, Dist. Ahmedabad-382213)
E-mail: ambarin@gmail.com • website: www.ambarprotein.com
Contact No: (02717) 250220 / 221 / 410 - F: (02717) 267123

EXTRACT OF UN-AUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31ST DECEMBER, 2025

(Rs. In Lacs)

Particulars	Quarter Ended		Nine Month Ended 31-12-25 (Unaudited)
	31-12-25 (Unaudited)	31-12-24 (Unaudited)	
Total Income from Operations (Net)	112491.97	11181.71	35385.63
Net Profit / (Loss) for the period (before tax, Exceptional and / or Extraordinary items)	258.63	398.05	595.56
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and / or Extraordinary items)	181.43	282.42	456.25
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and / or Extraordinary items)	181.43	282.42	456.25
Total Comprehensive Income for the period [Comprising profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	0.16	0.07	0.48
Equity Share Capital	575	575	575
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of the Previous Year)	-	-	-
Earning Per Share (of Rs. 10/- each) (for Continuing and discontinued Operations)	3.16	4.91	7.94
(a) Basic	3.16	4.91	7.94
(b) Diluted	3.16	4.91	7.94

Note :

1. The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on the website of the Company (www.ambarprotein.com) and on the website of BSE Ltd. (www.bseindia.com)
2. The impact on net profit / loss, total comprehensive income or any other relevant financial item(s) due to change(s) in accounting policies shall be disclosed by means of a footnote.
3. Exceptional and/or Extraordinary items adjusted in the Statement of Profit and Loss in accordance with Ind-AS Rules / AS Rules, whichever is applicable.

For and on behalf of Board

For, AMBAR PROTEIN INDUSTRIES LIMITED
Sd/-
Pradeep C. Khetani
Managing Director
(DIN : 01786030)

Date : 02-02-2026

Place : Ahmedabad

Regd. Office: A-33104, Sub Floor, Parineema Complex, C.G. Road, Ettumanoor, Ahmedabad-382006
Tel. +91- 9925018030. Email: Investor@galaxybearings.com • Website: www.galaxybearings.com

PUBLIC NOTICE

Regarding Special Window for Transfer and Dematerialisation of Physical Securities

Pursuant to SEBI Circular HO/38/13/112/2026-MIRS/POD/L/3750/2026 dated January 30, 2026, a special one-year window has been opened for transfer and dematerialisation of physical shares, where the transfer deed was executed prior to April 01, 2019.

The Special Window shall remain open from 05 February 2026 to 04 February 2027.

Pursuant to the said circular, investors having transfer deeds executed prior to April 01, 2019, including:

- Fresh lodgement cases; and
- Transfer requests earlier rejected / returned / not attended due to deficiencies.

may submit their transfer and dematerialisation requests during the special window. Eligible investors may lodge / re-lodge their requests with the Company's Registrar to an Issue and Share Transfer Agent, M/s Alankit Assignments Limited, along with the requisite documents as prescribed under the SEBI circular.

The securities so transferred shall be credited only in dematerialised form and shall be subject to a lock-in period of one year from the date of registration of transfer, as per SEBI guidelines.

Registrar to Issue & Share Transfer Agent (RTA) Details:

Alankit Assignments Limited

Address: 205-206, Anarkali Complex, Jhaveriwalla Extension, New Delhi – 110055
Tel: 011-4254 1234
Email: rtai@alankit.com
Website: <http://alankitassignments.com>

Detailed guidelines are also available on the Company's website at www.galaxybearings.com

Business Brief

Toyota Kirloskar Motor Recorded Sales of 33,880 Units in Jan. 2026

Bengaluru, Toyota Kirloskar Motor (TKM) today announced its sales performance for the month of January 2026, with the total sales of 33,880 units compared to 29,371 units sold in January 2025. This includes 30,630 units sold in domestic market while 3,250 units were exported, reflecting sustained customer demand across key models and TKM's continued commitment to delivering reliable, value-driven mobility solutions. Commenting on the sales performance, Mr. Sabir Manohar, Executive Vice President, Sales-Service-Used Car Business, Toyota Kirloskar Motor, said, "The year 2026 started on a positive and encouraging note, with continued momentum of our product portfolio and customers' trust in our commitment to quality, safety and sustainability. A key highlight during January was the launch of the All-Electric URBAN CRUISER EBELLA, further strengthening our focus on delivering future-ready mobility solutions aligned with evolving customer expectations.

Asian Energy Announces New Oil Discovery at Mevad Field

Mumbai, Asian Energy Services Limited (Asian Energy), announced the discovery of oil at the onshore Mevad field in Gujarat, following the drilling and testing of a new well with expected peak production of approximately 125-130 barrels of oil per day (bpd). The well NM-01 was drilled to a total depth of 1,650 metres, encountering three hydrocarbon-bearing sand intervals—Mandhali, Sobhasan, and Kajol. These zones are being evaluated sequentially. The well is currently producing approximately 100 bpd in the testing phase from Sobhasan sand, with data indicating potential production rates of 125-130 bpd.

CHANGE OF NAME

I have changed my old name from HARSHAL VINODBHAI NANDANI to new name HARSHAL VINODCHANDRA NANDANI

Add. 4, Vraj Complex, Satellite Road, Ahmedabad-380015

CHANGE OF NAME

I have changed my old name from MANOHAR RAMESHCHANDRA PUNJABI to new name MANOHAR RAMESH PUNJABI

Add. 602, Block 2, Iacon Riverside Shahibaug, Ahmedabad-461318

Gujarat Urban Development Company Limited

(Govt. of Gujarat Undertaking
CIN: U75154GJ1995G036051

Kamtrayn Bhavan, Block No.1, B1 Wing, Ground Floor, Sector-16, Gandhinagar-382016
Email: guudc@guudc.gov.in
www.guudc.gujarat.gov.in

E-Tendering Notice (Re-Invitation) Ref. No: GUUDC-TENDERING/Solar/2025/DPR

Gujarat Urban Development Company Ltd. invites online RFP's by e-tendering For "Empanelment of DPR Consultant (including Feasibility study) for the work of Solar Project at various locations of ULBs of Gujarat under SJMMSVY"

Tender documents will be available on the web site <https://tender.nprocure.com> from subsequent information, notification, changes and amendments would be posted only on the aforesaid website.

INF/2473/2025-26

UPL

UPL Limited

CIN: L24219GJ985PLC0205132

Regd. Office: 3-11, G.I.D.C., Vapi, Valsad-396195, Gujarat
Telephone: +91 260 2432716 | Email: upl.investors@upl-ltd.com | Website: www.upl-ltd.com

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31ST DECEMBER 2025

(₹ in Crore)

Particulars	Quarter ended		Nine months ended		Year ended (Audited)
	December 31, 2025 (Unaudited)	September 30, 2025 (Unaudited)	December 31, 2024 (Unaudited)	December 31, 2025 (Unaudited)	
Total Revenue from Operations	12,269	12,019	10,907	33,504	31,064
Profit / (Loss) before exceptional items and tax	727	642	430	1,188	(415)
Profit / (Loss) before tax	671	784	354	1,265	(548)
Profit / (Loss) for the period	490	612	853	926	(259)
Total Other Comprehensive Income / (Loss) for the period	412	1016	(567)	1,862	42
Total Comprehensive Income / (Loss) for the period	902	1,628	286	2,788	(664)
Total Comprehensive Income / (Loss) for the period attributable to owners of the parent	716	1,306	581	2,217	(328)
8 Paid up Equity Share Capital (Face Value of the Share - ₹ 2/- each)	169	169	155	169	155
9 Other Equity	-	-	-	-	29,054
10 Earnings per equity share (not annualised) Basic (₹) Diluted (₹)	4.69	6.75	9.70	9.59	(1.74)
	4.69	6.74	9.70	9.58	(1.74)

Notes:

1. The above is an extract of the detailed format of unaudited consolidated financial results for the quarter and nine months ended 31st December 2025 filed with the Stock Exchanges under Regulation 33 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 as amended ("SEBI LODR Regulations"). The full format of the unaudited financial results (consolidated and standalone) for the quarter and nine months ended 31st December, 2025 are available on the Company's website viz. www.upl-ltd.com and on the website of BSE (www.bseindia.com) and NSE (www.nseindia.com).

2. Key standalone financial information is as under:

Sr. No.	Particulars	Quarter ended		Nine months ended		Year ended (Audited)
		December 31, 2025 (Unaudited)	September 30, 2025 (Unaudited)	December 31, 2024 (Unaudited)	December 31, 2025 (Unaudited)	
1	Total Income from Continuing Operations	1,464	1,833	1,432	5,051	3,456
2	Profit before tax from Continuing Operations	61	355	301	548	333
3	Profit for the period from Continuing Operations	32	272	874	426	904
4	Profit before tax from Discontinuing Operations	-	-	90	-	339
5	Profit for the period from Discontinuing Operations	-	-	118	-	296
6						
7						
8						
9						
10						

3. The above results have been reviewed and recommended to the Board of Directors by the Audit Committee at its meeting held on 2nd February, 2026 and subsequently approved by the Board of Directors at its meeting held on 2nd February, 2026. These results have been subjected to limited review by the statutory auditor.

